

August 20, 2020

To,
The Secretary,
Department of Corporate Services,
BSE Limited,
25th Floor, Phiroj Jeejeebhoy Tower,
Dalal Street, Fort,
Mumbai: 400 001

Dear Sir/Madam,

Ref: **Company Code: 539384**
Sub: **Newspaper Publication: Intimation of Board Meeting**

As required under Regulation 47 of SEBI (LODR), Regulations, 2015, please find enclosed herewith newspaper advertisement Dated **19/08/2020** as published under the Companies Act, 2013 and rules made there under in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) in connection with the notice to consider and approve the un-audited Financial Results for the **First** quarter ended **June 30, 2020**.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,
For, **Krishna Capital & Securities Limited**



Ashok Kumar Agrawal
(Managing Director)
(DIN 00944735)

Realme launches 6000mAh Mega Power smartphones



Ahmedabad, The world's fastest-growing smartphone brand, realme, launched its entry-level value kings, the realme C12 and realme C15 with mega-powered 6000mAh batteries. realme also introduced the realme Buds Classic and realme T-shirt, strengthening its vision to become the most popular tech-lifestyle brand in India.

Commenting on the launch of the new products, Madhav Sheth, Vice President, realme and Chief Executive Officer, realme India, said, "Continuing our dare to leap dictum and aim to deliver best-in-class technology, we are delighted to introduce the realme C12 and realme C15. The realme C-series has been well received by our customers

globally that currently has over 15 million users. With the new members - realme C12 and realme C15 - we aim to redefine the C series by bringing multiple options in the entry-level segment. Both these smartphones are equipped with a massive 6000mAh battery and offer cutting-edge features in the sub INR 10K segment. We have also added the realme Buds Classic and realme T-shirt to our AIoT and lifestyle portfolio today to be able to offer our customers with stylish lifestyle products which they desire." The realme C12 and realme C15 feature a mega power 6000mAh battery which allows users long-hours of non-stop usage and a Super Power Saving Mode for better battery life. It also has special OTG reverse charge feature. Both smartphones are equipped with a 6.5" HD+ Mini-drop full-screen display with an aspect ratio of 20:9, offering consumers a larger field of view and excellent viewing experience. (19-10)

Renault Launches Duster With The 1.3L Turbo Petrol Engine



Ahmedabad, Renault India announced the launch of the 1.3L Turbo Petrol engine that will power one of the most successful SUVs in India, Renault DUSTER. With this, DUSTER becomes the most powerful SUV in its segment in India. The all new DUSTER with the 1.3L Turbo Petrol engine will be available in three variants with a 6-speed manual option at a starting price of INR 10.49 lakhs, while the X-Tronic CVT will be available in two variants with a starting price of INR 12.99 lakhs. Renault will also offer the option of the existing 1.5L Petrol engine and the Renault DUSTER range starts at INR 8.59 lakhs. "The launch of Renault DUSTER equipped with the 1.3L Turbo Petrol engine marks a new chapter in the DUSTER journey in India. This is a world-class engine and powers our

successful global SUVs and Crossovers like Kadjar and Arkana. DUSTER has achieved an iconic status in one of the most dynamic automotive markets. Over the years, adventure enthusiasts and numerous Indian families have established a strong bond with this True SUV. The bold and more powerful DUSTER will surely inspire more people to join the growing family of adventure seekers and explore new terrains and horizons, as well as enjoy the effortless driving experience," said Venkatram Mamillapalle, Country CEO & Managing Director, Renault India Operations. To further ensure a continued customer association, Renault has announced a loyalty benefit scheme including an AMC package exclusively for existing Duster owners upgrading to the new 1.3L Duster. (13-9)

The market for religious products in India is emerging as a new 'IT' for Investors



Ahmedabad, India is known for its soft power and peaceful religion, the daily worship and religious rituals here constitute a huge market for incense sticks, which are an integral part of Indian culture. The market for incense sticks and dhoop is more than 15000 crores and this is continuously growing at a speed of 15%. The Agarbatti and Dhoop segment is the fastest-growing market after IT in which investors are excited to invest. According to Mr. Sanjeev

Nayar, Director, Mode Retails Sales & Marketing Pvt. Ltd., post-COVID, the FMCG industry has taken a big hit. However, this sector has proved to be on a strong footing. Given the recent "Bhoomi-Poojan" of Shri Ram Temple in Ayodhya, the world has its eyes on India. With the surge in the devotion factor among the public, and also with the gradual opening of worship-places across the country, it will be a matter of time before the demand for Agarbatti and dhoop starts picking up once again. "Prabhu Shri Ram" (PSR), one of the newest brands of this FMCG segment that connects people emotionally, is producing incense sticks and Dhoop with 100% pure and natural fragrances. "Prabhu Shri Ram" (PSR), has attracted the investment talk of around 150 crores from overseas investors. It has entered into its final stage and the closure of these deals will be done soon as the talks are at the advanced level. (19-10)

Uttarakhand and east Rajasthan put on extremely heavy rain alert

Jaipur, Uttarakhand and eastern Rajasthan are likely to record heavy rainfall on Tuesday, while parts of Madhya Pradesh (MP) are likely to record extremely heavy rain, measuring over 20 centimetres (cm). India Meteorological Department (IMD) authorities have issued a red category warning for MP on Tuesday. Raisen in MP has already recorded 19 cm rain since Monday. Parts of Gujarat, including Tapi and Surat, have recorded 28 and 25 cm, respectively. The Central Water Commission (CWC) warned on Monday that water levels could rise in the following rivers such as Sutlej, Ravi, Beas, Ghaggar, Yamuna, Bhagirathi, Alaknanda, Ganga, Ramganga, Sarda, Sarju, and Ghaghra. There is a likelihood of flash floods in some of the hill districts in Uttarakhand along with cloudburst.

"Necessary precautions have to be taken for possible landslides and blockages of river flows due to landslides in high ranges of these states," the CWC said. It also said there is a moderate risk of flash floods in north Chhattisgarh, Madhya Pradesh (MP), eastern Rajasthan, and southern Gujarat. The monsoon trough is active and lies south of its

normal position (from Ganganagar to the Bay of Bengal). It is very likely to be active and near-normal/south of its normal position during next three-four days, IMD said in its morning bulletin on Tuesday. A convergence of strong moist southwesterly winds from the Arabian Sea over northwestern plains is likely to further strengthen during the next 24 hours.

Hyundai Announces Social Welfare CSR Initiatives



Ahmedabad, Hyundai Motor India Ltd., country's first smart mobility solutions provider and the largest exporter since inception today announced to continue the Independence Day Celebrations with commencement of COVID-19 CSR 2.0 Program under 'Hyundai Cares' campaign. In its 2nd phase during August-December 2020, Hyundai's philanthropic efforts will focus on 3 key activities - Health, Education and Clean India for strengthening the society to live in the new normal ecosystem for a Happy Life. "Every Independence Day brings celebrations along with a special social message for its fellow citizens. To commemorate the occasion, our CSR initiatives under Hyundai Cares 2.0 will continue till December 2020 focusing the important touch points of the society to help overcome pandemic while building a strong nation.", he further added. Over the last two decades, Hyundai has fostered a strong emotional connect with India and demonstrated admiration and respect for the country's traditions through its initiatives. (1-7)

building further on the strength of our phase 1 activities, we are glad to announce the phase 2 under Hyundai Cares 2.0 initiatives. Our efforts have taken the next dimension to focus on Health, Education and Clean India for strengthening the society to live in the new normal ecosystem for a Happy Life. "Every Independence Day brings celebrations along with a special social message for its fellow citizens. To commemorate the occasion, our CSR initiatives under Hyundai Cares 2.0 will continue till December 2020 focusing the important touch points of the society to help overcome pandemic while building a strong nation.", he further added. Over the last two decades, Hyundai has fostered a strong emotional connect with India and demonstrated admiration and respect for the country's traditions through its initiatives. (1-7)

Lootcase starring Kunal Kemmu and Rasika Dugal the biggest comedy movie




Ahmedabad, Within days of its release under Disney+ Hotstar Multiplex, comedy caper Lootcase has emerged as a massive hit on the platform. Starring Kunal Kemmu, Rasika Dugal, Gajraj Rao, Vijay Raaz, Ranvir Shorey and others, the movie witnessed a big opening weekend and has now become the biggest comedy movie on Disney+ Hotstar VIP. Released on 31st July 2020, Lootcase has received immense adulation from the fraternity, audiences and social media communities and has been lauded for its powerhouse talent with impeccable comic timing. Kunal Kemmu who portrays the role of an aamaadmi Nandan Kumar, "I've always believed that hard work pays off; and for Lootcase it surely did! To receive this kind of love and feedback from my peers and seniors from the industry and

love from fans - it's extremely overwhelming. A movie like Lootcase perfectly captures the essence of aamaadmi or common man in our country and what happens when their wildest dream of finding unclaimed cash comes true! This movie has the perfect blend of chaos, confusion and comedy and that's what I think has put a smile on everyone's faces" Rasika Dugal, who plays Nandan's wife in the comic caper says, "I am delighted that Lootcase has brought some cheer to people's lives in these gloomy times. Comedy is tough to do, but when a joke lands, there is nothing better than that. The audience seems to have noted and enjoyed not just the laugh out loud moments but also the smaller ones we managed to sneak in, not knowing if anyone would notice or not. People seem to be responding to all of it. That has been such a joy. (19-10)

Modi - 'People's Leader the 4th Longest Serving Prime Minister of India

Ahmedabad, In May 2014, PM Narendra Modi was first elected as PM when he led the Bharatiya Janata Party (BJP) to a landslide victory in the Lok Sabha elections winning 282 seats in the Lower House. Five years later, he again returned to power with an unprecedented 303 MPs. He took oath for his second term on May 2019 is set to become the longest serving non-Congress leader to occupy the office. With 2,272 continuous days in office Modi has surpassed the record held by the late Atal Bihari Vajpayee who served in office for 2,272 days across three separate terms. He also has the distinction of being the longest serving Chief Minister of Gujarat with his term spanning from October 2001 to May 2014.

number of days. Modi led the Bharatiya Janata Party to record wins, securing absolute majority on both occasions. The last time that a political party secured such an absolute majority was in the elections of 1984. He is the 4th Prime Minister of India who would serve two consecutive terms as Prime Minister of India and the first Non-Congress Party Prime Minister of India who would complete two consecutive terms. Modi has now spent more number of days in office than former prime minister Atal Bihari Vajpayee, who headed the first government of National Democratic Alliance (NDA). Veteran BJP leader Atal Bihari Vajpayee served in the office of Prime Minister across 3 tenures - 'Vajpayee 1' in May 1996 lasted 13 days as he resigned after not being able to establish a majority, then 'Vajpayee 2' that began on 19 March 1998 and ended on 10 October 1999 and lastly 'Vajpayee 3' that began on 10 October 1999 and concluded on 22 May 2004.



Vinod Chandrashekhar Dixit

Abdulaziz. Modi has been also been conferred the top awards of Russia (The Order of the Holy Apostle Andrew the First), Palestine (Grand Collar of the State of Palestine), Afghanistan (Amir Amanullah Khan Award), UAE (Zayed Medal) and Maldives (Rule of Nishan Izzuddeen). In 2018, PM received the prestigious Seoul Peace Prize for his contribution to peace and development. He has contributed immensely at both domestic and international level which has made him so popular and respected. There is no denying the fact that Narendra Modi has set a befitting example for the rest of the nation to follow. The prime minister of any nation has the obligation for authority and capability to lead the country towards the growth and Modi as the PM of India has shown it. Let us wish that he continues to lead us to accomplish many missions and milestones for our great nation.

If we go back to the records, besides Vajpayee and Modi, the other Prime Ministers with longest tenure include India's first Prime Minister Jawaharlal Nehru, who assumed office on August 15, 1947 stayed in the seat till May 27, 1964, a total of 6,130 days or almost 17 years. Indira Gandhi who assumed office on January 24, 1966 continued till March 24, 1977 and she returned as PM on January 14, 1980 and continued till her assassination on October 31, 1984. She was in office for 5,829 days whereas Dr Manmohan Singh remained as PM for 10 years between May 22, 2004 and May 26, 2014, a total of 3,656 days. Now Modi is on 4th with longest tenure. Previously Atal Bihari Vajpayee was the non-Congress PM who held the post for the highest

He has profoundly traveled across the globe promoting India's status as a 'young country' and thereby mobilizing business and investment options from the developed countries. His multi-tasking ability to travel the world over for tie-ups, administering the country through welfare schemes, keeping in touch with the common man through social media etc., makes even his political rivals to admire him. PM Modi has been conferred various honours including the highest civilian honour of Saudi Arabia Sash of King

dixitptrakr@yahoo.in
B-15 Jyoti-Kalash Society,
Jodhpur Tekra, Satellite,
Ahmedabad - 380 015

Amarnath Securities Limited
CIN NO. L67120GJ1994PLC023254
Regd. Office: Sarthak 1/104, Opp. C.T. Centre, Near Swastik Cross Road, C.G. Road, Navrangpura, Ahmedabad-380009.
www.amarnathsecurities.com
Corporate Office: Unit no 705, Minera Estate, A Wing, O2 Commercial Tower, Malad west-400080.

NOTICE
Pursuant to Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 notice is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday August 25, 2020 at 2.00 PM at the Corporate offices of the Company office of the Company Inter-alia, to consider and approve the Unaudited Financial Results of the Company along with Limited Review Report for the Quarter ended June 30, 2020 or discuss any other business Matter. This information is also available on the Company website at www.amarnathsecurities.com and on the website of the Stock Exchange at www.bseindia.com

For Amarnath Securities Limited
Sd/-
Naresh Padir
Whole-Time Director
Date: August 19, 2020 Din: 08379067
Place: Mumbai

YUG DECOR LIMITED
CIN: L24295GJ2003PLC042531
Regd. Office: 709-714, Sakar-V, B/h Natraj Cinema, Ashram Road, Ahmedabad - 380 009, Gujarat, India.
Ph. No.: +91 79 26580920 / 48955109,
E-mail ID: account@yugdecor.com, Website: www.yugdecor.com

NOTICE OF THE 17TH ANNUAL GENERAL MEETING, E-VOTING & BOOK CLOSURE

- NOTICE is hereby given that the 17th Annual General Meeting (AGM) of the Members of Yug Decor Limited (the Company) will be held on **Friday, 11th September, 2020 at 12:00 Noon** through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) facility, to transact the businesses as set out in the Notice of the 17th AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("LODR Regulations") read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated 8th April, 2020, 13th April, 2020 and 5th May, 2020 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular"), without the physical presence of the Members at a common venue.
- In terms of MCA Circulars and SEBI Circular, the Notice of the 17th AGM and the Annual Report 2019-20 including the Audited Financial Statements for the year ended 31st March, 2020 has been sent to those Members whose email address are registered/ updated with the Company/ Depository Participants. The Notice of the 17th AGM and the Annual Report is also available on the website of the Company at www.yugdecor.com, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and the AGM Notice is also available on the website of Central Depository Services (India) Limited (CDSL) (e-voting agency of the Company) at www.evotingindia.com.
- NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from **Saturday, 5th September, 2020 to Friday, 11th September, 2020** (both days inclusive), for the purpose of 17th AGM of the Company. The cut-off date / record date for the purpose of ascertaining the eligible shareholders to participate in the AGM and for payment of dividend, if approved at the AGM, is **Friday, 4th September, 2020**.
- Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the "Remote e-voting" facility provided by CDSL to cast their vote on all the resolutions set forth in the said Notice.
- The remote e-voting commences on **Tuesday, 8th September, 2020 (9:00 a.m.)** and ends on **Thursday, 10th September, 2020 (5:00 p.m.)**. During this period members holding shares as on the cut-off date may cast their vote by remote e-voting before the AGM. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. Additionally, the facility for e-voting shall also be made available at the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to exercise their right to vote at the AGM. Members who have exercised their right to vote through remote e-voting may participate in the general meeting but shall not be allowed to vote again in the meeting.
- The voting rights of members shall be in proportion to the equity shares held by them in the paid up equity share capital of the Company as on the cut-off date i.e. **Friday, 4th September, 2020**. Any person, who is a member of the Company as on the cut-off date is eligible to cast vote electronically through remote e-voting or e-voting facility at the AGM on all the resolutions set forth in the Notice of AGM.
- Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the list of beneficial owners maintained by depositories (CDSL & NSDL) as on cutoff date can exercise their voting rights by following the procedure as mentioned in the said Notice of AGM.
- If you have any queries or issues regarding attending AGM & e-voting from the e-voting system, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542).
- All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/ 43.

**By Order of the Board,
Krishna Capital & Securities Ltd**
Sd/-
Ashokkumar Agrawal
Managing Director
DIN: 00944735

Place: Ahmedabad
Date: 18/08/2020

SUNGOLD CAPITAL LTD
[CIN: L65910GJ1993PLC018956]
Regd off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla, Narmada - 393145.
Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, Off. Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064
Tel no: 022-28891692, 08108756812
Website: www.sungoldcapitallimited.com
Email: info@sungoldcapitallimited.com

NOTICE
NOTICE is hereby given that pursuant to regulation 47 read with Regulation 29 & 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company will be held on Thursday, August 27, 2020 at the Corporate office of the Company inter alia, to consider and approve the Unaudited Financial Results for the quarter ended June 30, 2020.

For Sungold Capital Ltd
Sd/-
Date: 18.08.2020
CS Versha Chaturani
Company Secretary & Compliance Officer

KRISHNA CAPITAL & SECURITIES LIMITED
(CIN: L67120GJ1994PLC023803)
Registered Office: 403, Mauryansh Elanza, B/h. Parekh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad: 380015,
Phone: 079-26768572, 26768573,
E-Mail: ksbsp@yahooin, Web Site: www.kcsl.co.in

NOTICE
Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on **Thursday, 27th August, 2020 at 4 p.m.** at the Registered Office inter alia to consider and take on record unaudited Financial Result for the 1st quarter ended on **30th June, 2020** under Regulation 29 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

**By Order of the Board
Krishna Capital & Securities Ltd**
Sd/-
Ashokkumar Agrawal
Managing Director
DIN: 00944735

Place: Ahmedabad
Date: 18/08/2020

